



સાઉથ ઈસ્ટ (લિંબાયત)ઝોન

ઈ-ટેન્ડર નોટીસ (ઓનલાઈન) નં.ડે.મ્યુ.કમિશનર/સા.ઈ.ઝોન/૦૧/૨૦૨૬-૨૭,

કામ નં.૧૧

ટેકનીકલ બીડ


સુરત મહાનગરપાલિકાનાં લિંબાયત ઝોનમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટે નિયત કરેલ જગ્યામાં પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા માટેનું ટેન્ડર.

ટેન્ડર ફી	:	રૂ.૧,૭૭૦/-
ટેન્ડર ડોક્યુમેન્ટસ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય	:	૨૫/૦૬/૨૦૨૬, ૧૮:૦૦ કલાક થી ૧૫/૦૭/૨૦૨૬, ૧૮:૦૦ કલાક સુધી
ઓફર ફોર્મ / પ્રાઈસબીડ, ટેન્ડર ફી, ટેન્ડર કોપી, બાનાની રકમ તેમજ ટેન્ડરના અન્ય બાકી જરૂરી પુરાવા (સ્કેન કરી) ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ અને સમય	:	૧૫/૦૭/૨૦૨૬, ૧૮:૦૦ કલાક સુધી
ટેન્ડર ફી, બાનાની રકમ હાર્ડ કોપી સીલબંધ કવરમાં સ્વીકારવાની છેલ્લી તારીખ / સમય	:	૨૩/૦૭/૨૦૨૬, ૧૮:૦૦ કલાક સુધી
ટેકનીકલ બીડ ઓપનીંગ (ઓનલાઈન) તારીખ / સમય	:	૧૬/૦૭/૨૦૨૬, ૧૬:૦૦ કલાક થી
ટેન્ડર ફી બાનાની રકમની હાર્ડ કોપી (ઓફરફોર્મ/પ્રાઈસબીડ સિવાય) સીલબંધ કવરમાં મોકલવાનું સરનામું	:	મુખ્ય હિસાબનીશશ્રી, હિસાબી ખાતુ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત.



"અનુક્રમણીકા"

અનુ.	વિગત	પાના નં.
(૧)	પરિશિષ્ટ – અ	૪
(૨)	પરિશિષ્ટ – બ	૫
(૩)	પરિશિષ્ટ – ક	૬
(૪)	પરિશિષ્ટ – ડ	૭
(૫)	પત્રક-૧ ટેન્ડરને સૂચના	૮
(૬)	પત્રક-૨ ટેન્ડરની શરતો	૧૦
(૭)	પત્રક-૩ હકીકત ફોર્મ	૨૧
(૮)	પત્રક-૪ બાંહેધરી પત્રક	૨૩



નોંધ

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીના તા.૦૫/૦૮/૨૦૨૧ ના ઠરાવ નં.૭૫૧/૨૦૨૧ મુજબ પે એન્ડ પાર્કના ઈજારાની કાળવણીની કામગીરીમાં અમલ કરવા વિનંતી છે.

એ.ડી.વી./આર.જે.પી./આ.નં. ૯૩
તા. ૦૮/૦૮/૨૦૨૧

૦
૨૨/૦૮/૨૦૨૧
એ.ડી.વી.જર(સી)
સુરત મહાનગરપાલિકા

ન. સ. રવાના : ઝોનલ ચીફશ્રી (તમામ ઝોન), ડેપુટી કમિશનરશ્રી (HQ) પ્રતિ... જાણ સારૂ
નકલ રવાના : આસી. મ્યુનિસિપલ કમિશનરશ્રી(તમામ ઝોન), કાર્યપાલક ઈજનેરશ્રી(ટ્રાફિક સેલ) પ્રતિ... અમલ સારૂ.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની તા.૫-૮-૨૦૨૧ ના
રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો :-

મ્યુ.કમિશનરશ્રીના તા.૫-૮-૨૦૨૧ ના પત્ર નં.સી.સ્થા.સ./૩૯૦ થી વિદિત થઈ, તેમાં જણાવેલ સવળી માહિતી ધ્યાને લઈ, સુરત મહાનગરપાલિકાના હવે પછી કાળવણી કરવામાં આવનાર તમામ પે એન્ડ પાર્કના કામોને નીચે પરિશિષ્ટમાં જણાવ્યા મુજબ A, B તથા C કેટેગરીમાં નિયત કરીને સીક્યોરીટી ડિપોઝીટ, પરફોમન્સ ગેરંટી તથા એડવાન્સ લાયસન્સ ફીઝ વસુલાત કરવાનું મંજૂર કરવામાં આવે છે.

પરિશિષ્ટ

કેટેગરી	સિક્યોરીટી ડિપોઝીટ	પરફોમન્સ ગેરંટી	એડવાન્સ લાયસન્સ ફીઝ
A	૨%	NIL	૧ માસ
B	૨%	૨૫%	NIL
C	૨%	૨૫%	૩ માસ

ઠરાવ નં.૭૫૧/૨૦૨૧ સર્વાનુમતે મંજૂર.

A.T.P. Shri.
K.K. Patel
સહાયક
ડિપુટી

DE-CSI
(જવળ.સ)

AMC

ફાઇલ નં. 2836
તા. ૧૧/૦૮/૨૧
સા.ઈ.એન. (વિનંતી)



" પરિશિષ્ટ – અ "

સુરત મહાનગરપાલિકાનાં લિંબાયત ઝોનમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટે નિયત કરેલ જગ્યામાં પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા અંગે ઈજારો આપવાનાં કામે ટેન્ડરે ભરવાની ટેન્ડર ફી, બાનાની રકમ, સીક્યુરીટી ડીપોઝીટ, પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટ તથા વાર્ષિક ઓછામાં ઓછી પરવાના ફીની વિગત :-

(૧)	વાર્ષિક ઓછામાં ઓછી પરવાના ફી	:	રૂ.૨૫,૪૧,૭૮૬/-
(૨)	ટેન્ડર ફી (નોન રીફંડેબલ)	:	રૂ.૧,૭૭૦/-
(૩)	ટેન્ડર સાથે ભરવાની બાનાની રકમ	:	રૂ.૨,૫૪,૨૦૦/-
(૪)	સીક્યુરીટી ડીપોઝીટ	:	સ્થાયી સમિતી ઠરાવ નં.૭૫૧/૨૦૨૧, તા.૦૫/૦૮/૨૦૨૧ મુજબ
(૫)	પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટ	:	

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઈસ્ટ (લિંબાયત)ઝોન
સુરત મહાનગરપાલિકા



" પરિશિષ્ટ – બ "

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬,
મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” નો લાભ લેનાર લાભાર્થીઓ /
ગ્રાહકો પાસેથી વસુલ કરવાના પાર્કિંગના મહત્તમ દર

- સરકારશ્રીનાં ઠરાવ ક્રમાંક : પરચ/૧૦૨૦૧૮/સીએમ-૪૧૯/પી, તા.૦૫/૧૨/૨૦૧૮ થી
મંજૂર કરવામાં આવેલ "પાર્કિંગ પોલીસી એન્ડ પાર્કિંગ બાયલોઝ" મુજબ પાર્કિંગનાં દર

ઓફ સ્ટ્રીટ – પ્રીમીયમ એરીયા

On and Off Street Parking - All Areas					
	0 to 3 hours	3 to 6 hours	6 to 9 hours	9 to 12 hours	12 to 24 hours
2 - wheelers	10	15	20	25	40

- **Note:** For more than 24 Hours, parking charges shall be computed based on the additional duration of parking as increment from 0. Bicycles and handicapped modified vehicles shall not be charged for parking.
-

Off Street Parking - Premium Areas				
	0 to 6 hours	6 to 12 hours	12 to 18 hours	18 to 24 hours
3 - wheelers	20	30	45	65
Cars	25	40	60	90
LCV	35	60	80	110
HCV	75	110	165	250

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઈસ્ટ (લિંબાયત)ઝોન
સુરત મહાનગરપાલિકા



" પરિશિષ્ટ – ક "

" પે એન્ડ પાર્ક " ના સ્થળ / ક્ષેત્રફળ દર્શાવતા પત્રક

અનુક્રમ	સ્થળની વિગત	ક્ષેત્રફળ (ચો.મી.)
(૧)	ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં "પે એન્ડ પાર્ક"	૧૫૮૩ ચો.મી.

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઈસ્ટ (લિંબાયત)ઝોન
સુરત મહાનગરપાલિકા



SURAT MUNICIPAL CORPORATION

Annexure-D

General Information of Contractor

Name Of work: *Tender for Pay & Park Scheme Pay & Park at T.P.Scheme No.8 (Umarwada), F.P.No.146, Opp.Multilevel Parking, Umarwada, Surat in South East (Limbayat)Zone.*

- 1 Name of contractor :
- 2 Full address (with telephone :
number)
- 3 Details of experience for the :
business of vehicle parking
(certified copies of the certificate
should be attached)
- 4 Whether the business of vehicle :
parking is currently carried out? If
yes, Give details with proper
evidences (Tenderer is entitled to
attach the seperate sheet for the
details if required)

I / We, the undersigned, am / are desirous of getting contract for providing the "Pay and Park" services at the fixed rates at the reserved space at _____ of Surat Municipal Corporation. We enclose herewith the demand Draft / pay order NO.(1) _____ (2) _____ dated _____ drawn on _____ bank, towards the amount of Tender fees & Earnest money Deposit respectively. I / We have read the rules and terms and conditions in this regard, and I / We agree with same. I / We have submitted this tender after inspecting the site properly.

Date: / / 2026

Signature and seal of the Tenderer



પત્રક-૧

ટેન્ડરને સુચના

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટે નિયત કરેલ જગ્યામાં પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા બાબત.

- (૧) ટેન્ડર નોટીસમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટેના ટેન્ડર ફોર્મ ઈજારદાર / એજન્સી/સંસ્થાને <https://smctender.nprocure.com> વેબ સાઈટ પરથી ઉપલબ્ધ થશે. ટેન્ડર ફી (નોન રીફંડેબલ) અને બાનાની રકમ (EMD) " કમિશનર, સુરત મહાનગર પાલિકા,સુરત " ના નામનો એકાઉન્ટ પે ડીમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર / બેંકસ ચેક (નેશનલ લાઈઝડ/ શીડયુલ્ડ બેંક) નો "Payable at Surat" થી આપવાનું રહેશે.
- (૨) નીચે જણાવેલ વિગતો ઓનલાઈન <https://smctender.nprocure.com> વેબ સાઈટ પર સબમીટ કરવાના રહેશે.
 - (A) સોલવન્સી સર્ટીફિકેટની નકલ.
 - (B) પ્રોફેશનલ ટેક્સ રજીસ્ટ્રેશનની નકલ/ ગુમાસ્તાધારા સર્ટીફિકેટની નકલ.
 - (C) પરમેન્ટ એકાઉન્ટ નંબર (પાન)ની નકલ.
 - (D) GST રજીસ્ટ્રેશનની નકલ.
 - (E) છેલ્લા ત્રણ વર્ષના ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ કર્યાની નકલ.
 - (F) ટેન્ડર ફી અને EMD ના ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની નકલ.
 - (G) અનુભવનો લેટર/ કરેલ કામના પુરાવા
 - (H) ધંધા વ્યવસાયના પ્રકાર વિષયક ઓળખ સંબંધિત ડોક્યુમેન્ટ દા.ત. પ્રોપરાઈટર હોય તો લેટરપેડ ઉપર સેલ્ફ ડેકલેરેશન/ ભાગીદારી પેઢીએ દરેક ભાગીદારના નામ સાથે, વિગતો સહિત પાર્ટનરશીપ ડીડ/ એચ.યુ.એફ. માટે કર્તાનાં પાવર ઓફ એટર્ની અને ડીડ/ પ્રાઈવેટ લિ. તથા લીમીટેડ કંપની માટે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ ધ્વારા ઈસ્યુ કરાયેલ 'સર્ટીફિકેટ ઓફ ઈન કોર્પોરેશન' (ધંધાના પ્રકાર મુજબ જે લાગુ પડતું હોય તે ડોક્યુમેન્ટ કાયદેસરની ઓળખના પુરાવા તરીકે અપલોડ/ રજૂ કરવાનાં થશે.)
 - (I) બિડર કોઈ પણ ઓર્ગેનાઈઝેશન / કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકાર/ મ્યુનિસિપલ કોર્પોરેશન / લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ધ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલ ન હોવો જોઈએ. તે માટે રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર અન્ડરટેકીંગ રજૂ કરવાનું રહેશે.



- (૩) દરેક ટેન્ડર સાથે પાર્કિંગના હકકો માટે જણાવેલ બાનાની રકમ (EMD) નો સ્થાનિક શીડયુલ બેંકનો પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ અચુક બીડવાના રહેશે. બાનાની રકમ વિનાના ટેન્ડર રદ થયેલ ગણાશે.
- (૪) ટેન્ડરે ટેન્ડર સાથે પોતાની કોઈપણ શરત રજૂ કરવાની નથી. શરતી ટેન્ડર રદ થયેલ ગણાશે.
- (૫) ટેન્ડર સ્વીકારવું કે કેમ તે અંગે સુરત મહાનગરપાલિકાનો હકક અબાધિત રહેશે અને તે અંગે કોઈ કારણો આપવામાં આવશે નહીં.
- (૬) ટેન્ડર ફી (નોન રીફંડેબલ) તથા (EMD) કવર ઉપર " ટેન્ડર નોટીસનો નંબર " તથા કામનું નામ " સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં "પે એન્ડ પાર્ક" અંગેના કામ" તેમ સ્પષ્ટ લખવાનું છે.
- (૭) દરેક ટેન્ડરે ટેન્ડર ફી તથા બાનાની રકમના સ્થાનિક રાષ્ટ્રીય / શીડયુલ બેંકના "કમિશનર, સુરત મહાનગરપાલિકા"ના નામના પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ કવર માં સીલબંધ કરી સુરત મહાનગર પાલિકા ની હિસાબી શાખામાં ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં સીલબંધ કવરમાં ફક્ત રજી.પોસ્ટ એ.ડી.થી અથવા સ્પીડપોસ્ટથી મોકલવાનું રહેશે. નિયત મુદત બાદ મળેલ ટેન્ડર સ્વીકારવામાં આવશે નહિ.
- (૮) બાનાની રકમના રાષ્ટ્રીય / સ્થાનિક શીડયુલ બેંકના પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ કવરમાં અચુક મુકવાનો રહેશે. જો તે કવરમાં સ્થાનિક શીડયુલ બેંકના પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ ન હશે તો ટેન્ડરરનું ટેન્ડર રદ થવાને પાત્ર રહેશે.
- (૯) સફળ ટેન્ડરર ધ્વારા ટેન્ડર ફોર્મનાં પત્રક-૩, અને પત્રક-૪, તથા ટેન્ડરના અન્ય પેજ પર દર્શાવેલ હોય તે તમામ નિયત જગ્યા એ અચુક સહી કરવાની રહેશે તે સિવાય ટેન્ડર માન્ય ગણાશે નહીં. સદર ટેન્ડર સુરત મહાનગરપાલિકાની હિસાબી શાખામાં જમા કરાવવાનું રહેશે.

ટેન્ડરની સહી :

કાર્યપાલક ઈજનેર
સા.ઈ.ઝોન (લિંબાયત)
સુરતમહાનગરપાલિકા



પત્રક-૨

*** પે એન્ડ પાર્ક ***

ટેન્ડરની શરતો

- (૧) પાર્કિંગની જગ્યાના પરવાનાની મુદત મહાનગરપાલિકા નક્કી કરે તે મુજબ એક વર્ષની અથવા તો સદર જગ્યાની મહાનગરપાલિકાને અન્ય કોઈપણ જાહેર હેતુ માટેના કોઈ પણ પ્રોજેક્ટ/કામગીરી માટે જરૂરી જણાય ત્યાં સુધી, તેમાંથી જે વહેલો હોય ત્યાં સુધીનો જ રહેશે.
- (૨) ઈજારદારે ગ્રાહકોના વાહનો સંભાળવાની જવાબદારી સ્વીકારી છે એમ સમજીને વાહનો ખોવાય જાય અથવા ચોરી થઈ જાય તો અથવા વાહનોને નુકશાન થાય તો ઈજારદાર તે માટે જવાબદાર રહેશે. સુરત મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં.
- (૩) ઈજારદારે વાહનો સાચવવા પોતે અથવા તેઓએ અધિકૃત કરેલ વ્યક્તિઓએ હાજર રહેવું પડશે.
- (૪) વાહન પાર્કિંગ સ્ટેન્ડ અંગેની સેવાઓ સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનરશ્રીના વખતો વખતના આદેશ પ્રમાણે મુકરર કરેલ ધોરણ મુજબ, મુકરર કરેલ દરે પુરી પાડવાની રહેશે. આ મુકરર કરેલું ભાવપત્રક ગ્રાહકો જોઈ શકે તે મુજબ દરેક પ્રવેશદ્વાર પાસે તેમજ પાર્કિંગમાં અન્ય જગ્યાઓ પર પાર્કિંગધારકોને દેખાઈ શકે તે રીતે સુરત મહાનગરપાલિકા સુચવે તે મુજબ પ્રદર્શીત કરવાનું રહેશે.
- (૫) વાહન સ્ટેન્ડની કામગીરી અંગે જરૂરી સરકારી/અર્ધસરકારી અથવા મહાનગરપાલિકાના પરવાના ઈજારદારે મેળવી લેવાના રહેશે.
- (૬) ઈજારદારે વાહન સ્ટેન્ડ અંગે એક ફરીયાદ પોથી સ્ટેન્ડ પર ગ્રાહકોને સહેલાઈથી ઉપલબ્ધ થાય તે રીતે રાખવાની રહેશે, અને તેમાં નોંધાયેલી ફરીયાદ/સુચનો દર મહિને જે તે ઝોનના આસી.મ્યુ.કમિશનરશ્રીને મોકલી આપવાની રહેશે.
- (૭) ડોક્યુમેન્ટ ફી તથા બાનાની રકમનો ડીમાન્ડ ડ્રાફ્ટ/પે ઓર્ડર/બેન્કર્સ ચેક સુરત ખાતે વટાવી શકાય તે મુજબનો સ્થાનિક રાષ્ટ્રીય / શીડયુલ બેંકનો મ્યુનિસિપલ કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરત નામનો હોવો જોઈએ. ડોક્યુમેન્ટ ફી તેમજ નિયત બાનાની રકમ (ઈ.એમ.ડી.) વગરનું કવર સ્વીકાર્ય ગણાશે નહીં અને રદ થવાને પાત્ર રહેશે.
- (૮) ઈજારદારે તેમના ભાવો ઓફર ફોર્મમાં / પ્રાઈસબીડમાં ફક્ત ઇલેક્ટ્રોનિક્સ ફોર્મેટમાં ઓનલાઈન નિયત સમયમર્યાદામાં આપવાના રહેશે. ઓફર ફોર્મ / પ્રાઈસબીડ કોઈપણ સંજોગોમાં ફીઝીકલ ફોર્મેટમાં સ્વીકારવામાં આવશે નહીં, અને તે રદ થવાને પાત્ર રહેશે.
- (૯) શરતી ઓફર / ટેન્ડર રદ થવા પાત્ર છે. ફક્ત ઓનલાઈન ભરવામાં આવેલ ભાવો જ માન્ય ગણાશે.
- (૧૦) ટેન્ડર ફી, બાનાની રકમ સાથે સીલબંધ કવરમાં નિયત સમયમર્યાદામાં પહોંચે તે રીતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ થી સુરત મહાનગરપાલિકાના હિસાબી ખાતામાં મોકલી આપવાના રહેશે. ટેન્ડરર/ઓફરરે કવર પર નામ-સરનામા સહિત ટેન્ડર નોટીસ નંબર, કામ નંબર, કામનું નામ જણાવવાનું રહેશે. સ્પીડ પોસ્ટ / રજીસ્ટર પોસ્ટ એ.ડી. સિવાય અન્ય કોઈ રીતે મળેલ કવર સ્વીકાર્ય ગણાશે નહીં તેમજ નિયત મુદત / સમયમર્યાદા બાદ મળેલ કવર રદ થવાને પાત્ર રહેશે.



- (૧૧) પે એન્ડ પાર્કના ઈજારાની નિયત કરેલ મુદત પુર્ણ થયેથી મંજૂર ટેન્ડર / એલોટમેન્ટ લેટર / વર્કઓર્ડર ની શરતો તથા લાયસન્સ ફી ને આધિન / મુજબ એક તરફી ત્રણ માસ સુધી પે એન્ડ પાર્કના ઈજારાની મુદત લંબાવી / વધારી શકવા માટે સુરત મહાનગરપાલિકા સ્વતંત્રપણે અધિકૃત રહેશે. જે પરવાનેદારને બંધનકર્તા રહેશે.
- (૧૨) ઈજારદારને સોંપવામાં આવેલ પે એન્ડ પાર્કના હદ વિસ્તારમાં સમયાંતરે પુરતી ચકાસણી કરવાની રહેશે અને કાયદાથી પ્રતિબંધિત હોય તેવી વાંધાજનક / નુકશાનકારક કે અન્ય બિનવારસી ચીજ-વસ્તુઓ મુકવામાં આવે નહીં તેની કાળજી ઈજારદારે રાખવાની રહેશે. તેમજ આવી કોઈ વસ્તુ જણાય તો તાત્કાલિક જે તે સંબંધિત ખાતા / વિભાગને જાણ કરવાની રહેશે.
- (૧૩) ઈજારદાર તરફથી પે એન્ડ પાર્કની સેવાઓ પુરી પાડવા માટે રાખવામાં આવેલ તમામ માણસોને યુનિફોર્મ આપવાના રહેશે તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ નિયત ફોર્મમાં ઓળખપત્ર આપવાનું રહેશે. જે સંબંધિતે તેની ફરજ દરમિયાન જોઈ શકાય તેવી રીતે પ્રદર્શિત કરવાનું રહેશે. વધુમાં, પે એન્ડ પાર્કના સ્થળે પાર્કિંગની માહિતી/ભાવ/દર દર્શાવતા પોસ્ટર જરૂરિયાત મુજબ તેમજ આપવામાં આવતી સુચના મુજબ લગાડવાનાં રહેશે. તે સિવાયનાં કોઈ પોસ્ટર હોય તો ઈજારદારે દૂર કરવાનાં રહેશે.
- (૧૪) ઈજારાની મુદત પુરી થયા બાદ તે ઈજારો વધુ સમય માટે તાજો કરી આપવામાં આવેલ નહીં હશે તો ઈજારદાર અને તેના માણસોને ઈજારાના સ્થળમાં પ્રવેશ કરતા અટકાવી શકાશે. તથા ઈજારદારે સ્થળે રાખેલ તેમની સાધન સામગ્રી તાત્કાલિક ખસેડી લેવાની રહેશે. અન્યથા સુરત મહાનગરપાલિકા આવી તમામ સાધન સામગ્રી ઈજારદારના ખર્ચે અને જોખમે સ્થળ પરથી દુર કરશે.
- (૧૫) મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા તેમના અધિકૃત અધિકારી દ્વારા સહી કરેલ નોટીસ સુચના વિ. સાયકલ, સ્કુટર સ્ટેન્ડની જગ્યા ઉપર લગાડવામાં આવે તો તે ઈજારદારને મળ્યા બરાબર ગણાશે.
- (૧૬) ઈજારાની શરતો અંગે કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો, ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
- (૧૭) ટેન્ડર / વર્કઓર્ડર / એલોટમેન્ટ લેટર / એગ્રીમેન્ટની શરતો પૈકી કોઈપણ શરતનો પરવાનેદાર / ઈજારદાર દ્વારા ભંગ કરવામાં આવશે / પાલન કરવામાં કસુર કરશે તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઈજારદારની સુરત મહાનગરપાલિકાના ખાતે જમા તમામ પ્રકારની ડિપોઝીટની પુરેપુરી રકમ જપ્ત કરવાનો અધિકાર રહેશે તેમજ તે બાબતે નોટીસ વ્યવહાર પછી અથવા કોઈપણ પ્રકારની નોટીસ વિના ઈજારદારનો ઈજારો તત્કાલ રદ કરવાનો મ્યુનિસિપલ કમિશનરશ્રીને અધિકાર રહેશે. કરારના ભંગના પરિણામે સુરત મહાનગરપાલિકાને જે કંઈ નુકશાન થશે તે માટે પરવાનેદાર ભરપાઈ કરવા જવાબદાર રહેશે. પરવાનેદારે પરવાનાની શરતોનો ભંગ કર્યો છે કે કેમ અને ડીપોઝીટની રકમ જપ્ત કરવી કે નહીં તેમજ પેનલ્ટી કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય છેવટનો ગણાશે અને પરવાનેદારને તે બંધનકર્તા રહેશે તથા તે અંગે પરવાનેદારને કોઈપણ પ્રકારના વળતર મેળવવાનો હકક / અધિકાર રહેશે નહીં.



- (૧૮) મ્યુનિસિપલ કમિશનરશ્રી આ શરતો ઉપરાંત વખતોવખત સુચવે તેવા સુધારા કે નવી શરતો ઈજારદારને બંધનકર્તા રહેશે.
- (૧૯) ઈજારદારનું ટેન્ડર મંજૂર થયેથી સફળ ઈજારદારની મંજૂર થયેલ ઈજારાની ઓફર મુજબ ભરવાપાત્ર વાર્ષિક સમયગાળા માટેની થતી પુરેપુરી લાયસન્સ ફીની કુલ રકમના ૨૫% પ્રમાણેની રકમ પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટ રૂ.૨૫/- લાખથી ઓછી રકમ માટે બેંકર્સ ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ થી સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સીક્યુરીટી તરીકે જમા / ભરપાઈ કરવાની રહેશે. ઈજારદાર ઈચ્છે તો પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટની રૂ.૨૫/- લાખથી વધુની રકમ માટે સુરત શહેરની રાષ્ટ્રીયકૃત બેંકની ફીક્સ ડીપોઝીટ રસીદ (FDR) થી પણ રજુ કરી શકશે. ફીક્સ ડીપોઝીટ રસીદની પાકતી મુદતનો સમયગાળો ઈજારાની કામગીરીના નિયત સમગ્ર સમયગાળા ઉપરાંતના વધુ ૦૬ (છ) માસ સુધીનો રાખવાનો રહેશે.
- (૨૦) ઈજારદારનું ટેન્ડર મંજૂર થયેથી સફળ ઈજારદારની ઓફર મુજબની કુલ ટેન્ડર રકમ એટલે કે મંજૂર થયેલ ઈજારાની ઓફર મુજબ ભરવાપાત્ર સમગ્ર સમયગાળા માટેની થતી પુરેપુરી લાયસન્સ ફીની કુલ રકમના ૨% અથવા જે તે સમયના પ્રવર્તમાન દર પ્રમાણેની રકમ સીક્યુરીટી ડીપોઝીટ તરીકે રૂ.૦૨/- (બે) કરોડ સુધીની રકમના કામોએ બેંકર્સ ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સીક્યુરીટી ડીપોઝીટ તરીકે જમા / ભરપાઈ કરવાના રહેશે. રૂ.૦૨/- (બે) કરોડ ઉપરની રકમના કામમાં ઈજારદાર ઈચ્છે તો સીક્યુરીટી ડીપોઝીટની રકમ સુરત શહેરની રાષ્ટ્રીયકૃત બેંકની ફીક્સ ડીપોઝીટ રસીદ (FDR) થી પણ રજુ કરી શકશે. ફીક્સ ડીપોઝીટ રસીદની પાકતી મુદતનો સમયગાળો ઈજારાની કામગીરીના નિયત સમગ્ર સમયગાળા ઉપરાંતના વધુ ૬ (છ) માસ સુધીનો રાખવાનો રહેશે.

સફળ ઈજારદારે મહાનગરપાલિકાની કચેરીમાં ઉપરોક્ત શરત નં.(૧૯) અને (૨૦) માં જણાવેલ પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટ તેમજ સીક્યુરીટી ડીપોઝીટની રકમ જમા / ભરપાઈ કરવાની મુદત નવા કામ કે જેના માટે સ્થળે પાર્કિંગની કામગીરી સ્થળ ઉપર શરૂ કરવામાં આવેલ / થતી હોય તેવા કામ માટે વર્કઓર્ડર / એલોટમેન્ટ લેટરની તારીખથી દિન-૧૫(પંદર)ની રહેશે. ત્યારબાદ ૦.૦૬૫ % પ્રતિદિન વિલંબ પ્રમાણે પેનલ્ટી વસુલવામાં આવશે.

- (૨૧) ઈજારદાર તરફથી મહાનગરપાલિકાની કચેરીમાં ઉપરોક્ત શરત નં.(૧૯) અને (૨૦) માં જણાવેલ પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટ તેમજ સીક્યુરીટી ડીપોઝીટની રકમ ઈજારો પૂર્ણ થયા બાદ ઈજારદાર તરફથી ઈજારાના સંચાલનની કામગીરી સંતોષકારક / ક્ષતિઓ રહિત શરત નં.(૧૭) ને આધિન યોગ્ય જણાયે મુકત કરવામાં આવશે.
- (૨૨) ઈજારદારનું ટેન્ડર મંજૂર થયેથી ઓફર મુજબ ૧ (એક) માસના પરવાના ફીની એડવાન્સ રકમ વર્કઓર્ડર મળ્યેથી દિન-૧૫ (પંદર) માં રોકડેથી / બેંકર્સ ચેક / ડીમાન્ડ ડ્રાફ્ટ થી સુરત મહાનગરપાલિકામાં ભરવાની રહેશે. નિયત મુદતમાં રકમ જમા કરાવવામાં કસુર થયેથી બાનાની / સીક્યુરીટી ડીપોઝીટ / પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે તથા ઈજારો આપોઆપ રદ થયેલ ગણાશે. પ્રથમ માસિક ફી ની એડવાન્સ રકમ વર્કઓર્ડરની તારીખથી દિન-૧૫(પંદર) જમા કરાવવાની રહેશે. ત્યારબાદ મોડા દિવસો ઉપર વાર્ષિક ૧૮% સાદા વ્યાજ સહિતની વિલંબ પેનલ્ટી વસુલવામાં આવશે.



- (૨૩) બાકીની વાર્ષિક લાયસન્સ ફી પ્રમાણેની રકમ ૧૧ (અગિયાર) માસના માસિક હપ્તામાં દર માસની તારીખ ૧ થી ૫ માં ભરપાઈ કરવાની રહેશે. તેમ ન થતાં વિલંબિત દિવસો ઉપર વાર્ષિક ૧૮% સાદા વ્યાજ સહિતની ડીલે પેમેન્ટ માટેની પેનલ્ટી લાગુ પડશે. લાયસન્સ ફીની વાર્ષિક રકમ સરખા માસિક હપ્તાઓમાં ભરવાના રહે છે તથા સદર રકમની ચુકવણી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના મહિનાની ૧ થી ૫ તારીખમાં કરાવવાની રહે છે. જો ઈજારો અંગ્રેજી મહિનાની પહેલી તારીખ સાથે શરૂ થતો ન હોય તો ઈજારાની શરૂઆત જે તારીખે થતી હોય તે તારીખથી શરૂઆતના / પહેલા માસમાં બાકી રહેતા દિવસો માટેની લાયસન્સ ફી વસુલ લેવાની રહેશે અને તેજ પ્રમાણે ઈજારાના છેલ્લા માસ માટે પણ કેલેન્ડર મહિનામાં બાકી રહેતા દિવસો માટેની લાયસન્સ ફી વસુલ લેવાની રહેશે. પ્રથમ તથા છેલ્લા કેલેન્ડર માસ સિવાયના બાકીના દસ માસ માટેની પૂરેપૂરા મહિનાની માસિક લાયસન્સ ફી ના પૂરેપૂરા હપ્તા જે તે માસની ૧ થી ૫ તારીખમાં ભરવાના રહેશે. માસ/દિવસની ગણતરી માટે એક માસ ૩૦(ત્રીસ) દિવસની સરેરાશ પ્રમાણે ગણતરીમાં લેવાનો રહેશે.
- (૨૪) બાકીની વાર્ષિક લાયસન્સ ફી પ્રમાણેની રકમના માસિક હપ્તા માટેની જે રકમ નક્કી થશે તેની જમાનત તરીકે ઈજારદારે જે તે રકમના / એડવાન્સ ચેકો તથા ટીસીએસ નાં એડવાન્સ ચેકો આપવાના રહેશે. સદર ચેક સુરત મહાનગરપાલિકા પાસે કસ્ટડીમાં જમા રાખવામાં આવશે તથા ઈજારદાર ઈચ્છે તો નિયત તારીખે રોકડા / ડ્રાફ્ટ અગર તો અન્ય કોઈ માન્ય રીતે રકમ જમા કરાવીને ચેક પરત લઈ શકશે. પરંતુ જો તેમ ન કરવામાં આવે તો પેમેન્ટ ચેકની તારીખ આવતા સદર ચેક સુરત મહાનગરપાલિકા ધ્વારા ચુકવણી માટે બેન્કમાં રજુ કરી દેવામાં આવશે અને જો આવા ચેક કોઈપણ કારણસર બેન્કમાંથી રીટર્ન થાય તો રીટર્ન ચેકના ચાર્જીસ / દંડ / વહીવટી ચાર્જ / ડીલે પેમેન્ટ પેનલ્ટી સહિત રકમ ઈજારદાર પાસેથી વસુલ કરવા સુરત મહાનગરપાલિકા હકકદાર રહેશે. તેમજ ચેકની રકમની વસુલાત કરવા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વસુલાત કરવા સુરત મહાનગરપાલિકા હકકદાર રહેશે.
- (૨૫) ઈજારો એક વર્ષ કરતાં વધુ સમય માટે ફાળવેલ હોય તેવા સંજોગોમાં વાર્ષિક ઈજારો પૂર્ણ થવાના એક માસ અગાઉ થી આગામી વર્ષ માટેના માસિક લાયસન્સ ફી મુજબના તથા પ્રવર્તમાન નીતિ નિયમ મુજબના ટી.સી.એસ. (TCS) / જી.એસ.ટી.(GST) સહિતના ૧૨ (બાર) ચેક એડવાન્સમાં જે તે ઝોન કચેરીમાં જમા કરાવવાના રહેશે.
- (૨૬) ઈજારદારનું ટેન્ડર મંજૂર થયા મુજબની જાણ ઈજારદારને કર્યેથી જરૂરી સીક્યુરીટી ડીપોઝીટ તેમજ પર્ફોર્મન્સ ગેરન્ટી ડીપોઝીટની રકમ ભરી જરૂરી કરાર કરી, સ્થળ ઉપર ઈજારા મુજબની કામગીરી શરૂ કરી લેવાની રહેશે. સદરહુ ઈજારાની મુદત ઈજારદારને સ્થળ પર કામ શરૂ કરવા માટે આપવામાં આવનાર વર્કઓર્ડર/એલોટમેન્ટ લેટર/પરવાનગી પત્રમાં જણાવેલ તારીખથી ગણવાની રહેશે.
- (૨૭) ઈજારદારે ઓફર આપતા પહેલા પાર્કીંગ સ્ટેન્ડની જગ્યા તથા તેની હદ વિસ્તાર પુરેપુરો જોયો હોવાનું માની લેવામાં આવશે. પાછળથી આ બાબતે કોઈ તકરાર ચાલશે નહીં.



- (૨૮) પાર્કિંગ સ્ટેન્ડવાળી જગ્યા પર કોઈ ટેમ્પરરી કે પરમેનન્ટ શેડ / સ્ટ્રક્ચર ઈજારદાર બાંધી શકશે નહીં. તથા જાહેરાત કરી શકશે નહીં.
- (૨૯) પાર્કિંગ સ્ટેન્ડનો સમય રાઉન્ડ ઘ કલોક (૨૪ કલાક) સુધીનો રહેશે. અથવા પે એન્ડ પાર્કના લોકેશનની સ્થળ પરિસ્થિતિ મુજબનો રહેશે.
- (૩૦) ટેન્ડર મંજૂર થયેથી ઈજારદારે ઓફર મુજબ થતી રકમ ભરપાઈ કરવાની રહેશે.
- (૩૧) સફળ ઈજારદારે સુરત મહાનગરપાલિકા સાથે અમલીકરણ બાબતે પ્રવર્તમાન નિયમ મુજબના જરૂરી એગ્રીમેન્ટ પ્રવર્તમાન નિયમ મુજબના સ્ટેમ્પ પેપર પર સ્વખર્ચે કરવાનો રહેશે.
- (૩૨) સફળ ઈજારદારે નિયમ મુજબ જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર સ્યોરીટી બાબતનું લખાણ સ્વખર્ચે કરી આપવાનું રહેશે.
- (૩૩) ઈજારો મંજૂર થતાં ઈજારદારે તેમના રહેઠાણ તથા ધંધાના સ્થળનું પુરેપુરું ટપાલનું સરનામું, ફોન નંબર, ફેક્ષ નંબર, ઈ-મેઈલ એડ્રેસ વિગેરે વિગતો પુરી પાડવાની રહેશે તથા ભવિષ્યમાં તેમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે. ઈજારદારે જણાવેલ સરનામા ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા જે કાંઈ પત્ર વ્યવહાર કરવામાં આવે તે ઈજારદારને મળ્યા બરાબર ગણાશે.
- (૩૪) મ્યુનિસિપલ કમિશનરશ્રી જે – તે સમયે જણાવે / સુચવે તે મુજબ પાર્કિંગમાં આવવા તેમજ જવા માટેની એન્ટ્રી/એક્ઝિટ રાખવાની રહેશે.
- (૩૫) અનિવાર્ય સંજોગોમાં જ્યારે ઈજારદારને કામગીરીમાં નડતરરૂપ થાય અને "પે એન્ડ પાર્ક" બંધ રહે અથવા સક્ષમ સત્તા દ્વારા "પે એન્ડ પાર્ક" બંધ કરાવવામાં આવે ત્યારે કામગીરી બંધ થયાની/કર્યાની જાણ ઈજારદારે ૨૪(ચોવીસ) કલાકની અંદર જોનના સંબંધિત સ્ટાફને કરવાની રહેશે અને પાર્કિંગ બંધ રહે તે સમયગાળાના રેકૉર્ડની ખરાઈ જોનના સંબંધિત સ્ટાફ પાસે ઈજારદારે કરાવવાની રહેશે. સ્થળ તપાસ કરી માન્ય રાખવામાં આવે તે પ્રમાણે પરવાના ફી માંથી રાહત/મજરે આપવામાં આવશે.
- (૩૬) મહાનગરપાલિકાને જાહેરહિત માટેના કોઈ પણ અન્ય પ્રોજેક્ટ / કામગીરી માટે સદર જગ્યાના કોઈ ગાળા/ભાગની, તમામ ગાળા/ભાગની જરૂરીયાત જણાય તો, તે બાબતે ઈજારદારને દિન-૩૦ (ત્રીસ) ની મુદતની નોટીસ આપીને ઈજારો ટર્મીનેટ કરી પ્રશ્નવાળી જગ્યાનો પ્રત્યક્ષ કબજો સુરત મહાનગરપાલિકા મેળવી શકશે. તે અંગે ઈજારદાર કોઈ વાંધો લઈ શકશે નહિ.
- (૩૭) ઈજારદારે / પરવાનેદારે પે એન્ડ પાર્કના સંચાલન સાડુ પાર્કિંગ ચાર્જ / ફી માટેની રસીદ / ટોકન ઈશ્યુ કરવા માટે બજારમાં મળતા હાથ વડે સંચાલિત થઈ શકે તેવા ઇલેક્ટ્રોનિક સાધન / કોમ્પ્યુટર સ્થળ સ્થિતિ પ્રમાણે જરૂરીયાત મુજબની સંખ્યામાં, પોતાના ખર્ચે લાવવાના રહેશે તથા પે એન્ડ પાર્કમાં તેનો ઉપયોગ પાર્કિંગ ટીકીટ આપવા માટે કરવાનો રહેશે.
- (૩૮) ઈજારદારે / પરવાનેદારે બજારમાં મળતા હાથ વડે સંચાલિત થઈ શકે તેવા ઇલેક્ટ્રોનિક સાધન / કોમ્પ્યુટરથી મળી શકે તેવી પાર્કિંગ ટિકિટ પે એન્ડ પાર્ક માં ઈશ્યુ કરવાની રહેશે. જેના માટેની રસીદ / ટિકિટ સીરીયલ નંબર સાથેની સ્વયં પાર્કિંગ ચાર્જ દર્શાવી શકે તેવી સ્ટેશનરી રાખવાની રહેશે. વાહન પાર્ક કરનારને આપવાની ટીકીટના ભાગમાં પે એન્ડ પાર્ક નું સ્થળ, ઈજારદારનું નામ, વાહનનો પ્રકાર, નંબર, આવવા-જવાનો સમય વિગેરે વિગત દર્શાવતી સ્વયં પાર્કિંગ ચાર્જ દર્શાવતી હોવી જરૂરી છે.



- (૪૬) પે એન્ડ પાર્કમાં અલગ-અલગ ઝોન / જગ્યા / ફ્લોરમાં નકશામાં દર્શાવ્યા / જણાવ્યા મુજબનો વિસ્તાર ધ્યાને લેવામાં આવેલ છે. ઈજારદારની મંજૂર થયેલ ઓફર તથા કુલ વિસ્તાર ધ્યાને લઈ, પ્રતિ ચો.મી. નો મંજૂર દર ગણવામાં આવશે. ઈજારાના સમયગાળા દરમિયાન કોઈ કામગીરી માટે સંજોગોવશાત કોઈ ભાગનો સુરત મહાનગરપાલિકા અન્ય હેતુ માટે ઉપયોગ કરવા ઈચ્છે તો તેમ કરી શકશે અને તેમ કરતાં તેમજ કુલ ક્ષેત્રફળમાં ઘટાડો થાય (શરત નં.૩૫) તો ઉક્ત પ્રતિ ચો.મી.ના દરે સપ્રમાણસર લાયસન્સ ફી માંથી ઘટાડો કરી આપવામાં આવશે. તેમજ સ્થળે મળતા ક્ષેત્રફળમાં વધારો થવાથી અથવા કોઈ કારણસર સ્થળે મળતા ક્ષેત્રફળમાં વધારો થાય તો, ઈજારદારે લાયસન્સ ફીમાં સપ્રમાણસર વધારો આપવાનો રહેશે. ક્ષેત્રફળમાં વધારા-ઘટાડાની બંને પરિસ્થિતિઓ ઈજારદારે માન્ય રાખી તે મુજબની કામગીરી કરવાની રહેશે.
- (૪૭) પે એન્ડ પાર્કના પરવાના ફી ની રકમ ઉપરાંત રાજ્ય સરકારના નક્કી થયેલા ચાર્જ કે વખતોવખત લાગુ પડતા જે તે કાયદા હેઠળ નક્કી થતા ચાર્જ કે સરકારી/અર્ધસરકારી ટેક્સ/ચાર્જ/ફી/વેરા/GST ભરવાપાત્ર થતા તમામ વેરા આપવાની જવાબદારી ઈજારદારની રહેશે. ઉપરોક્ત ઈજારાની મુદત પુરી થયા બાદ પણ જો સરકારશ્રી / મહાનગરપાલિકા તરફથી આવું લેણું નીકળતું હશે તો સુરત મહાનગરપાલિકા ઈજારદાર પાસેથી તેવું લેણું વસુલ લેવા હકકદાર રહેશે.
- (૪૮) ઈજારદારે પે એન્ડ પાર્કમાં નક્કી કરેલ વાહનો નિયત થયેલ પાર્કિંગ વિસ્તારમાં જ પાર્ક કરાવવાના રહેશે તેમજ પે એન્ડ પાર્ક વિસ્તારમાં “વાહન ચાલકે પોતાના ખર્ચે અને જોખમે વાહન પાર્ક કરવું” (Park at vehicle's owner's risk) તેવું બોર્ડ પ્રદર્શીત કરવાનું રહેશે.
- (૪૯) ઈજારદારની જવાબદારી “પે એન્ડ પાર્ક” માં નિયત સ્થળે વાહન પાર્ક કરાવવાની છે. પાર્કિંગની જગ્યામાં પ્રવેશ/નિકાસ માટે નક્કી કરવામાં આવેલ અંદર / બહાર જવાના માર્ગનો જ ઉપયોગ વાહન પાર્કિંગ માટે કરવાનો રહેશે. ટ્રાફિકના નિયમનો ભંગ ન થાય તથા “નો-પાર્કિંગ ઝોન” માં વાહનો પાર્ક કરવામાં ન આવે તેની વાહનચાલકે તકેદારી રાખવાની રહે છે. પાર્કિંગની જગ્યામાં વાહન લાવતી વખતે, વાહન પાર્કિંગ કરવામાં આવ્યું હોય ત્યારે પાર્કિંગની જગ્યામાંથી વાહન બહાર કાઢતી વખતે ટ્રાફિક / દબાણ નાં તમામ નિયમોનું વાહનચાલકે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ખોટી રીતે વાહન ચલાવવા / પાર્ક કરવા બદલ જો વાહનોને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઈજારદારની રહેશે. મહાનગરપાલિકા કોઈપણ રીતે જવાબદાર રહેશે નહિ. વધુમાં, આવા સંજોગોમાં જો સક્ષમ સત્તા ધ્વારા દંડ કરવામાં આવે, અગર તો ટ્રાફિક, આર.ટી.ઓ., મહાનગરપાલિકાના ઝોન / દબાણ ખાતા અગર તો અન્ય કોઈ સક્ષમ સત્તા ધ્વારા વાહન જપ્ત (detain) કરી લેવામાં આવે, તો તે અંગે ઈજારદારને કસુરવાર ઠરાવી શકાશે નહિ પરંતુ તેની જવાબદારી વાહન ચાલક / માલિકની રહેશે.
- (૫૦) ઈજારદાર તરફથી સાઈટ ઉપર જે માણસો રોકવામાં આવે તે અંગે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના તમામ લાગુ પડતા નીતિ નિયમોનું કાયદાની મર્યાદામાં રહી પાલન કરવાનું રહેશે. ઈજારદારે સ્થળ ઉપર રોકેલ માણસોને લઘુત્તમ વેતનથી ઓછો પગાર આપી શકાશે નહીં. જો ઈજારદાર તરફથી આવા કોઈ પણ નીતિ નિયમ કાયદાનું પાલન થાય નહિં / ઉલ્લંઘન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ઈજારદારની રહેશે અને સુરત મહાનગરપાલિકાને એવા ઉલ્લંઘન માટે કોઈ પણ રીતે જવાબદાર ઠેરવી શકાશે નહીં.



- (૫૧) સુરત મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કની કામગીરી માટે ફાળવવામાં આવેલ જગ્યા ઉપર ઈજારદારને સુરત મહાનગરપાલિકા દ્વારા ફક્ત ઈજારો / પરવાનો / લાયસન્સ આપવામાં આવશે. સદર કામગીરી મેળવવા તથા પે એન્ડ પાર્કનું સંચાલન કરવા બાબત કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના લાગુ પડતા કાયદાઓ મુજબ જે કાંઈ અન્ય લાયસન્સ / પરવાનગી / મંજૂરી લેવાની થતી હોય, તો તે ઈજારદારે પોતાના ખર્ચે અને જોખમે સંબંધિત ખાતાઓ / વિભાગોમાં અરજીઓ કરી મેળવવાના રહેશે. તે અંગેની સઘળી જવાબદારી ઈજારદારની રહેશે.
- (૫૨) ઓફરનો વેલીડીટી પીરીયડ ઓનલાઈન મળેલ ઓફર / પ્રાઈસબીડ ખોલ્યાની તારીખ થી ૧૨૦ (એકસો વીસ) દિવસ સુધીનો રહેશે.
- (૫૩) ફોર્સ મેજર કલોઝ : કોઈપણ પ્રકારના કુદરતી કે માનવસર્જીત આફત (Disaster) ના કારણે જેવા કે પુર, ધરતીકંપ, વાવાઝોડુ વિગેરે, અગર તો કોઈપણ પ્રકારનાં અકસ્માત / હુમલા / હિંસાખોરી, જેવા કે આગ, મિલ્કત પડવી, ટોળા શાહી પથ્થરમારો, સાંપ્રદાયિક તોફાનો વિગેરેના કારણે પાર્કિંગમાં મુકવામાં આવેલ વાહનોને નુકશાન થાય નહી તે બાબતે શક્ય થાય તેટલી તકેદારી રાખવી. તેમ છતાં જો વાહનોને નુકશાન થાય તો આવા કાબુ બહારના સંજોગોના કારણે નુકશાનીની જવાબદારી ઈજારદારની કે સુરત મહાનગરપાલિકાની રહેશે નહિ.
- (૫૪) પે એન્ડ પાર્કના પાર્કિંગ વિસ્તારમાં પરિશિષ્ટ-બ મુજબના નિયત કરેલ વાહનો પાર્ક કરાવવાના રહેશે.
- (૫૫) પે એન્ડ પાર્ક માં વાહનો સાચવવા જરૂરીયાત મુજબ સીક્યોરીટી સ્ટાફની વ્યવસ્થા ઈજારદારે પોતાના ખર્ચે કરવાની રહેશે.
- (૫૬) પાર્કિંગ એરીયામાં ૧૦% એરીયા સીનીયર સીટીઝન તથા વિકલાંગો માટે અનામત રાખવાનો રહેશે.
- (૫૭) જવલનશીલ / વિસ્ફોટક અગર કાયદા દ્વારા પ્રતિબંધિત ચીજ વસ્તુ પાર્કિંગમાં રાખવામાં આવેલ વાહનમાં રાખી શકાશે નહિ. તે અંગે થનાર નુકશાનની / કાયદેસરની કાર્યવાહીની જવાબદારી ઈજારદારની કે સુરત મહાનગરપાલિકાની રહેશે નહી.
- (૫૮) આ કામે કોઈપણ પ્રકારના દાવા પ્રકરણો સુરત શહેર તાબાની નામદાર કોર્ટના હકુમતક્ષેત્રને આધિન રહેશે. (Subject to Surat Jurisdiction)
- (૫૯) ઈજારદાર પોતાનો ઈજારો / પરવાનો બીજા પેટા ઈજારદારને તબદીલ કરી શકશે નહી. જો તેમ કરેલ જણાશે તો ભરેલ ડીપોઝીટની રકમ જપ્ત કરવા માટેની તથા ટેન્ડર શરતો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કાળી યાદીમાં મુકવા સુધીની કાર્યવાહી કરી શકાશે.
- (૬૦) પે એન્ડ પાર્ક માટે આપેલ ઈજારાવાળી જગ્યા ઈજારદારને લાયસન્સ પદ્ધતિથી ફાળવેલ છે. ઈજારદારને કોઈપણ પ્રકારના માલિકી / ભાડુતરીકેના અર્થાત ટેનન્સી રાઈટસ પ્રાપ્ત થતાં નથી અને થશે નહી. સદર જગ્યાની માલિકી તથા કબજો સુરત મહાનગરપાલિકાની છે અને રહેશે.



- (૬૧) કેન્દ્ર સરકારનાં કાયદા અનુસાર નિયત કરેલ દરે લાયસન્સ ફી ઉપર “ જી.એસ.ટી.” ભરવાનો રહેશે. સરકારશ્રી ધ્વારા વખતોવખત લાગુ કરેલ કર ભરવાનો રહેશે.
- (૬૨) સદર કામમાં જી.એસ.ટી. નાં કાયદા હેઠળ જી.એસ.ટી. લાગુ પડે છે કે નહીં? કેટલા ટકા? તેમજ HSN/SAC કોડ ઈજારદારે પોતાના સી.એ. પાસેથી મેળવી ટેન્ડર સાથે સબમીટ કરવાનું રહેશે. ઈજારદારે જી.એસ.ટી. નંબર / જી.એસ.ટી. રજીસ્ટ્રેશનની નકલ ટેન્ડર સાથે સામેલ કરવાની રહેશે. સરકારશ્રી ધ્વારા વખતો વખત લાગુ કરવા પાત્ર કર ભરવાનો રહેશે.
- (૬૩) ટેન્ડર માટે બાનાની રકમ (ઈ.એમ.ડી.) તથા ટેન્ડર ફીનાં ડીમાન્ડ ડ્રાફ્ટ ઓનલાઈન સ્કેન (ક્લર સ્કેન) કરી ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ટેન્ડર અપલોડ કરવાના રહેશે. આ પ્રકારે રજુ થયેલ વિગતે બાનાની રકમ અને ટેન્ડર ફી મળેલ ગણવાની રહેશે અને તદઅનુસાર ટેન્ડર ખોલવામાં આવશે તે અનુસાર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં બાનાની રકમ અને ટેન્ડર ફી મળેલ હોય તેની જ ઓફર ખોલવામાં આવશે. ખરેખર ચુકવણી માટે ટેન્ડર ભરનારે ડીમાન્ડ ડ્રાફ્ટ અસલમાં રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી./ સ્પીડ પોસ્ટ થી એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ (મેઈન ઓફિસ) માં અપલોડીંગની છેલ્લી તારીખથી નિયત કરેલ તારીખ સુધીમાં મળે તે અનુસાર રજુ કરવાના રહેશે. અસલમાં ડીમાન્ડ ડ્રાફ્ટ નહીં મોકલનાર સામે શિક્ષાત્મક પગલા (ટેન્ડર ફી તેમજ બાનાની રકમ નિયત સમયમાં ઈજારદાર ન ભરે તો ઈજારદારની નોંધણી એક વર્ષ માટે એબેન્સમાં રાખવાની કાર્યવાહી કરી ઈ-ટેન્ડરીંગનો કોડ એક વર્ષ માટે રદ કરાશે.) લેવામાં આવશે. ટેન્ડર બીડનાં માટે જરૂરી આધાર માટેના કોઈપણ ડોક્યુમેન્ટ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સ્કેન કરી મોકલવાના રહેશે અને હાર્ડકોપી અલાયદી રીતે સ્વીકારવામાં આવશે નહીં.
- (૬૪) "પે એન્ડ પાર્ક"નાં સંચાલન માટે ઈજારદાર ધ્વારા થયેલ વીજ વપરાશનું બીલ લાયસન્સ ફી ઉપરાંત અલગથી ઈજારદાર ધ્વારા આપવાનું / ભરવાનું રહેશે. તેમજ ઈજારો પૂર્ણ થતા સમગ્ર ઈજારા દરમિયાન સર્વીસ પ્રોવાઈડર ધ્વારા પાઠવવામાં આવેલ બીલ તેમજ તે ભર્યાની રસીદો સહિત તેઓ તરફથી કોઈ ચુકવણુ બાકી ન હોવાની ચોકસાઈ જુના ઈજારદારે નવા ઈજારદારને તેમજ ઝોનના સંબંધિત સ્ટાફને કરાવવાની રહેશે. ત્યાર બાદ ચકાસણીને અંતે યોગ્ય જણાયે ઈજારદારની તમામ પ્રકારની સીક્યુરીટીની રકમ મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
- (૬૫) "પે એન્ડ પાર્ક"માં જરૂરીયાત મુજબના પૂરતા પ્રકાશની વ્યવસ્થા ઈજારદારે સ્વખર્ચે કરવાની રહેશે. તે માટે બલ્બ, ટ્યુબ લાઈટ વિગેરે ઈજારદારે પોતાના ખર્ચે વસાવી / લાવી લગાડવાના રહેશે.
- (૬૬) "પે એન્ડ પાર્ક"માં સાફસફાઈની જવાબદારી ઈજારદારની રહેશે. તેમજ તેના ભંગ બદલ શરત નં. ૪૨ માં સમાવિષ્ટ પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ દંડને પાત્ર રહેશે.
- (૬૭) વર્કઓર્ડર આપ્યાના દિન-૧૫(પંદર)માં ઈજારદાર દ્વારા સ્થળ પર કબજો મેળવવામાં આવે કે મેળવવામાં ન આવે તો દિન-૧૬(સોળ) થી સ્થળ પર પે એન્ડ પાર્કની કામગીરી શરૂ કરેલ હોવાનું માનવામાં આવશે.



(૬૮) એક જ કેલેન્ડર માસમાં પાંચથી વધુ વખત એક જ પ્રકારની ગેરરીતી / શરતભંગ પકડાય ત્યારે ઈજારો રદ કરવામાં આવશે.

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઈસ્ટ (લિંબાયત)ઝોન
સુરત મહાનગરપાલિકા

ઉક્ત તમામ શરતો મેં વાંચી છે અને મને કબુલ મંજૂર છે.

ટેન્ડરની સહી તથા સિક્કો
તારીખ:




હું નીચે સહી કરનાર શ્રી _____ સરનામું

સંસ્થા હોય તો તે સંસ્થાનું નામ :-

તથા સંસ્થા સાથેનો સંબંધ :-


ઉપર જણાવેલ ટેન્ડરની તમામ શરતો પૂરેપૂરી વાંચી, સમજી અને તે પ્રમાણે વર્તવાની ખાતરી આપીને આ ટેન્ડર ભરવામાં આવેલ છે, અને ઉપરોક્ત શરતો પ્રમાણે વર્તવાની હું શ્રી _____ આથી લેખિત બાંહેધરી આપું છું.

—: માલિક / ભાગીદારના ફોટા નામ તથા સહી :—




નામ : _____

સહી : _____




નામ : _____

સહી : _____



નામ : _____

સહી : _____



નામ : _____

સહી : _____

(નોંધ : જો વધુ ભાગીદાર હોય તો બીજી અલગ શીટ સામેલ કરી તેમાં ફોટા ચોટાડી નામ તથા સહી દર્શાવવા.)



પત્રક-૩

હકીકત ફોર્મ

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલા ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટે નિયત કરેલ જગ્યામાં પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા બાબત.

પાર્કિંગનો ધંધો કરવા માટેની એસોસિએશનની એજન્સી કે જ્યાં એક વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ કોઈ સંસ્થા બનાવી હોય તેમણે પુરી પાડવાની માહિતી.

- (૧) સંસ્થાનું નામ :
- (૨) સરનામું :
- (૩) સંચાલકનું પૂરેપૂરું નામ :
- (૪) સંચાલકનું સરનામું :
- (૫) ભાગીદારનું નામ

(૧)

સરનામું:—

(૨)

સરનામું:—

(૩)

સરનામું:—

- (૬) શોપ એસ્ટા. નંબર / રજી. નંબર :
- (૭) સેલ્સ ટેક્ષ / સર્વિસ ટેક્ષ નંબર :
- (૮) કાયમી ઈન્કમેટેક્ષ રજીસ્ટ્રેશન નંબર :
- (૯) ભાગીદારના કરારની પ્રમાણિત નકલ :
- (૧૦) મ્યુનિ. કોર્પો. સાથે પત્ર વ્યવહાર તથા :
લેવડ દેવડ માટે અધિકૃત કરેલ
પ્રતિનિધીનું નામ તથા સરનામું

- (૧૧) પે એન્ડ પાર્કની આજદિન સુધી તથા :
તે પહેલાની સંચાલકોની તેઓની સીસ્ટર
કન્સનેની મ્યુનિ. કોર્પોરેશનની કોઈપણ



ફી બાકી ન હોવાનું સર્ટીફિકેટ અથવા
પહેલાની કોઈપણ ફી બાકી નીકળતી
હોય, તો તે આપવા બાબતની લેખિત
બાંહેધરીની નકલ.

(૧૨) ભેગી તથા વ્યક્તિગત રીતે કંપની કે :
એસોસીએશન વિગેરેની જે કંઈ
જવાબદારી ઉભી થાય તેના માટે
જવાબદારી લેવા બાબતની લેખિત
બાંહેધરીનું લખાણ.

ઉપરોક્ત જણાવ્યા મુજબની હકીકત મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે અને તેની અમો
ખાસ ખાતરી તથા બાંહેધરી આપીએ છીએ.

સહી:—

નામ:—

માલિક / ભાગીદારનું નામ:—

(૧)

(૨)



પત્રક-૪

બાંહેધરી પત્રક

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલા ટી.પી.સ્કીમ નં.૮(ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૪૬, મલ્ટીલેવલ પાર્કિંગની સામે આવેલ ઓપન પ્લોટમાં “પે એન્ડ પાર્ક” માટે નિયત કરેલ જગ્યામાં પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા બાબત.

આથી હું નીચે સહી કરનાર _____ રહે.

_____ આ ટેન્ડરમાં જણાવેલ તમામ શરતો પૂરેપૂરી વાંચી, સમજી તે પ્રમાણે વર્તવાની ખાત્રી આપીને આ ટેન્ડર ભરુ છું. આ ટેન્ડર ફોર્મમાં જણાવેલ લોકેશન ઉપર પાર્કિંગને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા મે નિયત મુદત માટે મેળવવા માટે સુરત મહાનગરપાલિકાને મે ઓફર કરેલ લાયસન્સ / પરવાના ફી તથા તે ઉપરાંત તમામ મ્યુનિસિપલ, સરકારી, અર્ધસરકારી કરવેરાઓ, વિગેરે તમામ અલગથી નિયમ મુજબ નિયત સમયમાં ભરવાની હું બાંહેધરી આપું છું.

આ ટેન્ડર સાથે નિયત કરેલ ટેન્ડર ફી રૂા. _____ સુરતની શીડયુલ / રાષ્ટ્રીય બેંકમાં વટાવી શકાય તેવા પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ નં. _____ તા. _____, _____ બેંક તથા બાનાની રકમ રૂા. _____ સુરતની શીડયુલ / રાષ્ટ્રીય બેંકમાં વટાવી શકાય તેવા પે ઓર્ડર / ડિમાન્ડ ડ્રાફ્ટ નં. _____ તા. _____, _____ બેંક સુરતનો આ સાથે સામેલ કરેલ છે.

સંસ્થાનું નામ તથા સીકકો :-

સંસ્થાનું પુરું સરનામું :-

ટેન્ડરરનું પુરું નામ :-

ટેન્ડરરની સહી :-

તા. / /૨૦



TAXES, DUTIES, OCTROI, ETC. :

The Contractor shall be liable to payment of all the Central/ State/Local Bodies' Levies, taxes or duties etc. The SMC shall neither bear it nor reimburse at any time but will ensure deduction of Central/State/Local levies and taxes at Source at the rate provided under the relevant statutes from time to time in force. Further the work contract tax or GST shall be borne by the Contractor as per Rules and Regulations of Government.

1% Construction Cess will be deducted from respective R.A. Bill and Final bill in accordance with the prevailing norms of Govt. of Gujarat.

GST clause for construction/ erection/commissioning / installation/ repairs/ maintenance/ renovation/ fabrication of structure including building (means all works, contracts/turnkey projects/ supply of materials/ goods).

GST (Goods & Service Tax) has come in existence from 1 July 2017. Contract / Successful Bidder is bound to pay any amount of GST prescribed by the Govt. of India as per the Terms of Contract agreed upon during the course of execution of this Contract.

During the course of execution of contract, if there is any change in Rate of GST (Goods & Service Tax) by the Government the same shall be reimbursed / recovered separately by SMC subject to the submission of Original Receipt / proof for the amounts actually remitted by the successful Tenderer / Contractor to the competent authority along with a certificate from Chartered Accountant of Contractor / Successful Bidder certifying that the amount of GST paid to the Government and the same shall be intimated / submitted /claimed within 30 Days from the date of payment Remittance of GST within stipulated period shall be the sole responsibility of the Successful Bidder / Contractor, failing which SMC and decision of Municipal Commissioner shall be final and binding on the Contractor / Successful Bidder in this regard Further the non-payment of GST to the Government may lead to the termination of contract and forfeiture of security Deposit / Performance Guarantee Amount.

If imposition of any other new Taxes / Duties / Levies / Cess or any other incidentals etc. or any increase in the existing Taxes / Duties / Levies / Cess or any other incidentals etc. (Excluding GST) are imposed during the course of the contract the same shall be borne by the Contractor / Successful Bidder only in no case SMC shall be liable for the same.



ANNEXURE-A
AFFIDEVIT

Name of Work: -

- I the undersigned do hereby certify that all the statements made in the required attachments are true and correct. I also understand that in case of wrongful/false information, corporation is entitled to take any civil & criminal punitive action against me / us .
- The undersigned also hereby certifies that neither our firm M/S nor any constituent partners have abandoned any work in india nor any contract awarded to us has been rescinded during last five year, prior to the date of this bid.
- The undersigned hereby authorize (s) and request (s) any bank, person, authorities, government of public limited institutions, firm or corporation to furnish pertinent information deemed necessary and requested by the SMC to verify our statements of our competence and general reputation etc.
- the undersigned understands and agrees that further qualifying information may be requested and agrees to furnish any such information at the request of the SMC.
- The SMC and its authorized representatives are hereby authorized to conduct any inquiries of investigations to verify the statements, documents and information submitted in connection with this bid and to seek clarification from our bankers and clients regarding any financial and technical aspects. This Affidavit will also serve as authorization to any individual or authorized representative to any institution referred ti in the supporting information to provide such information deemed necessary and requested by representative of Surat Municipal Corporation to verify statements and information provide in the Tender of with regard to the resources, experience and competence of the Applicant.

.....
Signed by the Authorize signatory of the firm

.....
Title of the Office

.....
Name of the firm

Date:

Note:- The affidavit format as indicated above to be furnished on non-judicial stamp Paper of Rs.300 and duly notarized



ANNEXURE-B

- Demand Draft for E.M.D. & Tender (Bid) fee shall be submitted in electronic format through online mode (by scanning) while uploading the bid. This submission shall mean that E.M.D. & tender fee are received for purpose of opening of the bid. Accordingly offer of those shall be opened whose E.M.D. & tender (bid) fee is received electronically. However, for the purpose of realization of D.D. bidder shall send the D.D. in original through RPAD / Speed post reach to Chief Accountant, SMC within 7 days from the last date of online submission of the bid as per tender notice.
- Penaltative action will be taken for not submitting original Demand Draft in the account department of Surat Municipal Corporation within 7 days from the last date of online submission of the bid for the first time as mentioned below.

Sr. No.	Tender Amount	Penalty Amount in Rs.
1.	Up to Rs. 1 Crore	Rs. 10,000/-
2.	More than Rs. 1 Crore and Upto Rs. 10 Crore	Rs. 20,000/-
3.	More than Rs. 10 Crore and Upto Rs. 50 Crore	Rs. 30,000/-
4.	More than Rs. 50 Crore and Upto Rs. 100 Crore	Rs. 70,000/-
5.	More than Rs. 100 Crore	Rs. 1,00,000/-

- If bidder will not submit the penalty amount within 10 days to Surat Municipal Corporation and/or bidder will not submit the demand draft in original for the second time and after, Penaltative action shall be taken for abeyance of registration and cancellation of E-tendering code for 6 (six) months.
- Any documents in supporting of bid shall be in electronic format only through online (by scanning) & hard copy will not be accepted separately.
- All documents must be colored scanned to be seen as original. Scanning in black and white of gray shall not be acceptable
- All the documents must be notarized with clearly displaying stamp, number and name of the notary.

"Following Documents shall only be submitted in HARD COPY to Surat Municipal Corporation by all bidders."

- Earnest Money Deposit as Mentioned in the tender. (i.e.D.D.)
- Tender fees as mentioned in the tender
- Affidavit on Non Judicial Stamp Paper of Rs. 300/-